

GMM/SEC/2021-22/63

February 4, 2022

To,

**BSE Limited**

Phiroze Jeejeebhoy Towers,  
1<sup>st</sup> Floor, Dalal Street,  
Mumbai – 400 001

**National Stock Exchange of India Limited (NSE)**

Exchange Plaza, C-1, Block G,  
Bandra Kurla Complex, Bandra (E)  
Mumbai – 400 051

**Scrip Code: 505255**

**Symbol: GMMPFADLR**

**Sub: Copy of Published Unaudited Standalone & Consolidated Financial Results for the quarter ended on December 31, 2021**

**Ref.: Regulation 30 read with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“SEBI Listing Regulations”)**

Dear Sir/Madam,


In terms of Regulation 30 read with Regulation 47 of the SEBI Listing Regulations, please find enclosed a copy of the Unaudited Standalone and Consolidated Financial Results for the quarter ended on December 31, 2021 approved at the meeting of the Board of Directors held on February 3, 2022 and published in Economic Times, Mumbai Edition and in Naya Padkar, Anand Edition on February 4, 2022.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,

For **GMM PFAUDLER LIMITED**



**Mittal Mehta**

Company Secretary and Compliance Officer  
FCS No.: 7848

# 'Telecom is Looked at as a Growth Driver Now'

**ET Q&A** The government believes the telecom reforms announced mid-September have started to show early results, says Department of Telecommunications (DoT) secretary K Rajaram. Speaking to **Economic Times**, Singh Manikotia & Muntazir Abbas, Rajaram says the government will price 5G to make the services affordable as the telecom sector is viewed as an engine to drive growth and not for maximising revenue. The second generation of reforms, he says, will further reduce the compliance burden on operators and should be released in the next months. Edited excerpts:

**Your take on the overall state of the industry?**  
The worst is behind the industry with three private players and BSNL. The reforms have shown fairly good early results. We expect this process of reforms to further help the industry.

**Did the September 2021 reforms play a role in facilitating Google's investment into Bharti Airtel?**  
I do think so because the idea of the macroeconomic reforms has been to support investment and reduce cost of doing business. So, from that perspective, any foreign investor would look at India very positively.

**What will be the focus of the next set of telecom reforms?**  
We are looking at deepening the process of ease of doing business, essentially compliance. Last year, 37 compliances were done away with. A number of other licences, both wireless as well as wireline.



**ON COMPLIANCE**  
Licences, both wireless (& wireline), need to be further simplified  
**K RAJARAM**  
DoT Secretary

need to be further simplified. In addition, there are new areas where improvements would happen, such as satellite communications and M2M learning.

**Does Vodafone Idea's computation of government equity potentially at 35.8% tally with DoT's calculation?**  
This aspect is currently being dealt with by the Ministry of Finance. This is the first of its kind of calculation and we should have clarity in the next one and a half months.

**Is the government open to reducing the 5G base price?**  
We want to offer high-quality, affordable 5G services to people. Telecom is not being guided by revenue maximisation but being looked at as a growth driver (Trai) in the process of looking at this and we look forward to their recommendation.

**FOR FULL REPORT, GO TO WWW.ECONOMICTIMES.COM**

# Trai Extends Deadline to Implement Broadcast Norms Again

NTO 2.0 to now come into effect by Jun 1; broadcasters asked to submit revised channel pricing by Feb 28

**Our Bureau**  
Mumbai: The Telecom Regulatory Authority of India (Trai) has once again extended the deadline for the implementation of the new broadcast sector tariff regulations—commonly known as NTO 2.0—by three months to June 1. As per the previous schedule, the new channel and bouquet pricing for consumers was to take effect on April 1. Broadcasters have been asked to submit their updated reference interconnect offer (RIO) by February 28, including the MRP of their channels and bouquets, as well as other interconnect agreement terms and conditions. Those who already had RIOs in line with NTO 2.0 can update and submit new ones before the end of the month. Meanwhile, distribution platform operators (DPOs)—DTH and cable companies—will have to disclose their distributor retail pricing (DRP) of channels and bouquets, as well as other information, by March 31. "All distributors of television channels shall ensure that, with effect from June 1, services to the subscribers are provided as per the bouquets or channels opted by the subscribers," Trai said in a letter. The regulator also stated it had received several representations from stakeholders requesting that the time limit for implementing the new regulatory framework be extended until 2020 due to the Covid situation.

**GRINDWELL NORTON LTD.**

Regd. Office: Leela Business Park, 5th Level, Andheri-Kurla Road, Marol, Andheri (E), Mumbai 400 059. Tel: + 022-40212121 \* Fax: 022-40212102 \*  
Email: sharecmpt.gno@saint-gobain.com \* Website: www.grindwellnorton.co.in  
CIN - L29593MH1950PLC008163

**SAINT-GOBAIN**

## Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine months ended December 31, 2021

Sr. No.	Particulars	(Rs. in lakhs)		
		Quarter ended 31-12-2021 (Unaudited)	Nine months ended 31-12-2021 (Unaudited)	Quarter ended 31-12-2020 (Unaudited)
1	Total Income	51,909	1,49,542	46,260
2	Net Profit / (Loss) after tax	6,965	20,492	6,545
3	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	6,921	20,359	6,498
4	Paid up Equity Share Capital (Face Value Rs. 5/- each)	5,536	5,536	5,536
5	Basic & Diluted Earnings per share (before extraordinary items) (of Rs. 5/- each) (not annualised)	6.30	18.60	5.96
6	Basic & Diluted Earnings per share (after extraordinary items) (of Rs. 5/- each) (not annualised)	6.30	18.60	5.96

Key numbers of Unaudited Standalone Financial Results of the Company for the Quarter and Nine months ended December 31, 2021 are as under:

Sr. No.	Particulars	(Rs. in lakhs)		
		Quarter ended 31-12-2021 (Unaudited)	Nine months ended 31-12-2021 (Unaudited)	Quarter ended 31-12-2020 (Unaudited)
1	Total Income	51,687	1,49,118	46,214
2	Profit Before Tax	9,329	28,034	8,953
3	Net Profit for the period	7,015	20,930	6,687

**Note:**  
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results for the Quarter and Nine months ended December 31, 2021, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.grindwellnorton.co.in  
2. The above financials were reviewed by the Audit Committee and approved by Board of Directors at their meeting held on February 3, 2022.  
3. The figures for the corresponding previous period have been restated/regrouped wherever necessary, to make them comparable.

**B. Santhanam**  
Managing Director  
Director Identification No. 00494806

## कार्यपालक अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, वृद्धयपुर

**शुद्धि पत्र**

यसु द्वारा सुचित किया जाता है कि डि.डी. कार्यालय द्वारा आमंत्रित अय्यकालीन इं. निविदा, जो जल जीवन मिशन के तहत विद्यमान वर्ष 2021-22 में वृद्धयपुर प्रमंडल अंतर्गत Construction of Solar Based Mini Water Supply Schemes (SVS) in Different Block, comprising of suitable R.C.C/Framed structure ES, Distribution Lines, Source (as required) and FHTC all complete job in the Different block से संबंधित है तथा जिसका नं. निविदा सूचना संख्या - SVS/MWSS in different Block - 07/2021-22 (2<sup>nd</sup> Call), दिनांक 17.01.2022 तथा जिसका PR संख्या - PR 261919 (West Singhbhum) 01-22, D. है, में अनिर्दिष्ट करवस निम्नलिखित संशोधन किया जाता है। शेष सटीक यथावत् रहेगी।

क्र. सं.	Clause	पूर्व में प्रस्तावित	संशोधित
4	बीड प्रक्रिया की अंतिम तिथि एवं समय	दिनांक 03.02.2022 अथवा 4.00 बजे तक।	दिनांक 08.02.2022, समय 2.00 बजे अथवा 4.00 बजे तक।
5	अप्रधान की शक्ति एवं परिभाषा (विद्यमान का मूल्य जमा करने की शक्ति, समय एवं स्थान)	कार्यपालक अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, वृद्धयपुर/अतिरिक्त अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, वृद्धयपुर/क्षेत्रीय प्रमुख अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, सीपी प्रोबेज रोड़ी	कार्यपालक अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, वृद्धयपुर/अतिरिक्त अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, वृद्धयपुर/क्षेत्रीय प्रमुख अभियंता का कार्यालय, पेयजल एवं स्वच्छता प्रमंडल, सीपी प्रोबेज रोड़ी

**RO:450**  
**RO.DT:03.02.2022,W:16.00,H:25.00**

## GMM PFAUDLER LIMITED

Registered Office: Vithal Udyog Nagar, Karamsad 388 325, Gujarat, India  
CIN No: L29199GJ1962PLC001171, Email ID : investorservices@gmmpfaudler.com  
Website : www.gmmpfaudler.com

### EXTRACT OF STATEMENT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

Sr. No.	Particulars	Consolidated			
		Quarter Ended		Year Ended	
		31.12.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.12.2021 (Audited)	31.03.2021 (Audited)
1	Total Income from Operations	642.28	201.81	1,841.20	1,001.12
2	Net Profit (before tax, Exceptional and/or Extraordinary items)	49.67	31.95	89.66	100.38
3	Net Profit before tax (after Exceptional and/or Extraordinary items)	49.67	31.95	89.66	67.46
4	Net Profit after tax (after Exceptional and/or Extraordinary items)	37.69	23.11	58.09	63.40
5	Total Comprehensive Income for the period	33.90	25.03	69.91	87.10
6	Paid up Equity Share Capital (Face value of ₹ 2/- each)	2.92	2.92	2.92	2.92
7	Other Equity (Reserves)				404.22
8	Earnings Per Equity Share on net profit after tax (Fully paid-up equity share of ₹ 2/- each)				
	1. Basic	21.77	15.85	47.21	50.19
	2. Diluted	21.77	15.85	47.21	50.19

**Notes:**  
(i) The above is an extract of the detailed format of quarter and nine months ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly financial results are available on the Stock Exchange websites viz. www.bseindia.com and www.nseindia.com. The same is also available on the company's website viz. www.gmmpfaudler.com.  
(ii) The Board of Directors have announced a third interim dividend of ₹ 1/- per share for the current financial year 2021-22. The record date for the payment of the said dividend has been fixed on February 11, 2022.  
(iii) The above results for nine months ended December 31, 2021, includes amortisation of intangibles acquired as part of Pfaudler business acquisition amounting to ₹ 44.54 Crores.  
(iv) An inventory step-up of ₹ 92.18 Crores was recorded on February 1, 2021, and out of which ₹ 45.66 Crores was charged to cost of material consumed during the year ended March 31, 2021, and remaining ₹ 46.52 Crores (excluding foreign impact) was charged to cost of material consumed during the nine months ended December 31, 2021, which is based on sales of such stepped-up inventory. Period for sale of such stepped-up inventory was estimated to be approximately 4 months.  
(v) Results for the period relating to quarter and nine months ended December 31, 2021, and year ended March 31, 2021, include Pfaudler international business from February 1, 2021, hence figures for the quarter and nine months ended December 31, 2021, are not comparable with the figures for the quarter ended December 31, 2020.

**GMM Pfaudler**  
Defining the standard

Sd/-  
**Tarak Patel**  
Managing Director  
DIN: 00166183

Place : Mumbai  
Date: February 3, 2022  
www.gmmpfaudler.com

## EIH Limited

A MEMBER OF THE OBEROI GROUP  
Registered Office : 4, Mangoe Lane, Kolkata - 700 001  
Phone : 91-33-22486751, Fax : 91-33-22486785  
Website: www.eihltd.com, Email ID : isdho@oberoigroup.com  
CIN : L55101WB1949PLC017981

### EXTRACT OF STATEMENT OF FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2021

Sr. No.	Particulars	(Rs. in Crores)					
		Standalone			Consolidated		
		3 months ended 31.12.2021 (UNAUDITED)	9 months ended 31.12.2021 (UNAUDITED)	3 months ended 31.12.2020 (UNAUDITED)	3 months ended 31.12.2021 (UNAUDITED)	9 months ended 31.12.2021 (UNAUDITED)	3 months ended 31.12.2020 (UNAUDITED)
1	Total Income from operations	324.32	631.81	167.50	378.88	737.40	194.78
2	Net Profit / (Loss) before tax (before Exceptional items)	41.37	(114.78)	(55.07)	56.10	(131.25)	(67.41)
3	Net Profit / (Loss) before tax (after Exceptional items)	41.37	(142.15)	(55.07)	56.10	(131.25)	(67.41)
4	Net Profit / (Loss) after tax (after Exceptional items)	32.57	(110.91)	(41.53)	40.80	(110.91)	(55.78)
5	Total Comprehensive Income / (Loss) for the period	32.18	(112.08)	(40.84)	41.28	(103.33)	(58.58)
6	Paid-up Equity Share Capital (Face Value - Rs. 2 each)	125.07	125.07	125.07	125.07	125.07	125.07
7	Other Equity in the Audited Balance Sheet as at 31st March, 2021			2,800.59			2,979.38
8	Earnings per Equity Share on net profit after tax (fully paid up equity share of Rs. 2) :						
	(a) Basic	0.52	(1.77)	(0.67)	0.61	(1.80)	(0.91)
	(b) Diluted	0.52	(1.77)	(0.67)	0.61	(1.80)	(0.91)

**Notes:**  
1. The above is an extract of the detailed format of the Statement of Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of Financial Results is available on the Stock Exchange websites, www.bseindia.com, www.nseindia.com and on the Company's website, www.eihltd.com.  
2. The Statement of Financial Results were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on 3rd February, 2022. The statutory auditors have carried out a limited review of these financial results for the quarter and nine months ended 31st December, 2021.

**VIKRAMJIT SINGH OBEROI**  
Managing Director and Chief Executive Officer  
(DIN : 00052014)

New Delhi  
3rd February, 2022

